

અરજદારની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ.

અરજદાર પૂલકિત દીલીપભાઈ શાહની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિ.એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલી છે કે, તેઓ અરજીમાં જણાવેલ સરનામે રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઈમનો બનાવ બનેલ જે બનાવમાં તેમના **HDFC BANK**ના ક્રેડીટ કાર્ડના ખાતા માંથી રૂ. 48113/- ઉપડી ગયેલ હતા. જે બાબતે તેઓએ 1930 નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી. જે સબબ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સામાવાળાના **KOTAK MAHINDRA BANK** ના ખાતા નંબર 9947900206 ખાતામાં તેઓના ગયેલા નાણા પૈકી રૂ. 8000 & **KOTAK MAHINDRA BANK** ના ખાતા નંબર 9947900206 ખાતામાં તેઓના ગયેલા નાણા પૈકી રૂ. 8000 બી.એન.એસ.એસ.ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતાં, જે હાલ સુધી સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં, જણાવેલ છે કે, આ બાબતે એફ.આઈ.આર. થયેલી નથી. તેઓને ખૂબજ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય, સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે ત.ક.અ.શ્રી / નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર નાઓએ હાલના અરજદારે કરેલી મુદ્દામાલ પરત મેળવવાની અરજી બાબતે તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, હાલના અરજદાર સાથે સાયબર ક્રાઈમનો બનાવ બનેલ, જેમાં અરજદારના એકાઉન્ટમાંથી અરજદારની અરજી મુજબનાં નાણાં ઉપડી ગયેલા હતાં. જે બાબતે અરજદારે પોતાની ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ આધારે અરજદારના ખાતામાંથી ગયેલા નાણાં પૈકી સામાવાળાનાં ઉપરોક્ત ખાતામાં રૂ. 16000/- બી.એન.એસ.એસ.ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા મેળવવા માટે અરજદારે આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સાડું તેઓનો અભિપ્રાય માંગેલ છે, જે બાબતે તેઓએ જણાવેલ છે કે, અરજદારના નાણાં સામાવાળાના જે ખાતામાં ગયેલ તે બેંક ખાતા બનાવટી હોવાનું તપાસમાં જાણવા મળેલ છે તથા સદરહું ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી, જેથી તે રૂપિયા અરજદારને પરત આપવા તેમનો અભિપ્રાય થાય છે.

આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંકમાં જમા હોય તથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં, નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ. પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતાં પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ :-

અરજદારની અરજી આથી ફોજદારી કાર્યરીતિઅધિનિયમની કલમ-૪૫૭ હેઠળ મંજૂર કરવામાં આવે છે.

અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ. 16000/- પુરા દોઢી રકમના જાત જામની (બોન્ડ) તથા તેટલી જ રકમના સંધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

વધુમાં, હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સંધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાત તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી તેમજ **SARASWAT CO.OPERATIVE BANK LTD** ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સંધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦ માં તેમની બેંકના **KOTAK MAHINDRA BANK** ના ખાતા નંબર **9947900206** ખાતામાં તેઓના ગયેલા નાણા પૈકી રૂ. 8000 & **KOTAK MAHINDRA BANK** ના ખાતા નંબર **9947900206** ખાતામાં તેઓના ગયેલા નાણા પૈકી રૂ. 8000 જમા છે તે રકમ અરજદારના **BANK OF BARODA** ના ખાતા નંબર **03270100017764** માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

-:: શરતો ::-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે આ નાણાં અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો હક / હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
- (૩) આ કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અરજદારે સદર મુદ્દામાલ રોકડ નાણા અન્ય કોઈને ગીરો, બક્ષીશ કે અન્ય કોઈ રીતે ટ્રાન્સફર કરવા કરાવવા નહીં.
- (૪) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહીત કામે ઉપયોગ કરવો / કરાવવો નહીં.
- (૫) કોઈપણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજ રોજ તા.૧૪ મી માહે-સપ્ટેમ્બર, સને-૨૦૨૪ ના રોજ લોક અદાલતમાં વાંચી, સંભળાવી મારી સહી કરી જાહેર કર્યો.

અમદાવાદ.

તા.૧૪-૦૮-૨૦૨૪

(ડો.ભારતી જી. રાઠોડ)

૩૭ માં એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,

કોર્ટ નં. ૨૨, અમદાવાદ શહેર.

કોડ નં. - GJ 01481